

ફેક્સ : (૦૭૯)૨૬૩૦૨૬૫૪  
ટેલીફોન : ૨૬૩૦૧૩૪૧/૨૬૩૦૦૩૪૨-૪૩  
: ૨૬૩૦૦૧૨૬ - ૨૬૩૦૦૬૬૪  
ટેલીગ્રામ : યુનિ.ગુજરાત



Fax : (079)26302654 & 26306194  
Phone : 26301341/26300342-43  
6300126 & 26300664  
Telegram : UNIGUJARAT

ગુજરાત યુનિવર્સિટી  
**GUJARAT UNIVERSITY**  
www.gujaratuniversity.ac.in

ગુજરાત યુનિવર્સિટી કાર્યાલય  
પોસ્ટ બોક્સ નં. ૪૦૧૦  
નવરંગપુરા અમદાવાદ-૩૮૦૦૦૯  
નં. આર./૨૬૧૧/૨૦૨૨

OFFICE OF THE GUJARAT UNIVERSITY  
POST BOX NO. 4010, NAVRANGPURA,  
AHMEDABAD-380009. (INDIA)  
તારીખ: ૨૬/૧૧/૨૦૨૨

પ્રતિ,  
આચાર્યશ્રી/ડાયરેક્ટરશ્રીઓ,  
ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજો તથા  
ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન ભવનો

**વિષય:-** ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ગુજરાત રાજ્ય શાખા દ્વારા વિદ્યાર્થીઓનું થેલેસેમિયા સ્ક્રીનીંગ કરાવવા બાબત.  
**સંદર્ભ:-** ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ગુજરાત રાજ્ય શાખાના પરિપત્ર નં. TPP/૫૪૪, તારીખ: ૧૭/૧૧/૨૦૨૨.

માનનીય સાહેબશ્રી,

ઉપરોક્ત વિષય તથા સંદર્ભ પરત્વે જણાવવાનું કે ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાં એક છે. જન સમુદાયનાં ઉત્થાન માટે ગુજરાત રાજ્ય શાખા અનેકવિધ માનવતાવાદી કાર્યક્રમો કરી રહી છે. ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા ૩૪ યુનિવર્સિટીઓ સાથે સંકળાયેલ છે અને સંસ્થા ધ્વારા જુજ લોકોનું થેલેસેમિયા પરિક્ષણ કરવામાં આવેલ છે જેમાં થેલેસેમિયા માઈનરનું પ્રમાણ ૪ થી ૫ ટકા જણાય છે.

આથી આપશ્રીઓને સંસ્થાના વિદ્યાર્થીઓને આ સાથે બીડેલ ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખાના પરિપત્ર મુજબ થેલેસેમિયા પ્રિવેન્શન પ્રોગ્રામ અંતર્ગત થેલેસેમિયા સ્ક્રીનીંગ ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દ્વારા કરાવવા આપશ્રીને નમ્ર વિનંતી છે.

સહી/-  
કુલસચિવ

બિડાણ: ઉપર મુજબ.

**નકલ સદર રવાના:**

૧. ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજોના તમામ આચાર્યશ્રી/ વિભાગીય વડાશ્રીઓ તરફ
૨. ગુજરાત યુનિવર્સિટીના સંલગ્ન તમામ ભવનોના અધ્યક્ષશ્રીઓ તેમજ વિભાગોના વડાશ્રીઓ તરફ.
૩. ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, ગુજરાત રાજ્ય શાખા તરફ





THROUGH HUMANITY TO PEACE

# Indian Red Cross Society



## Gujarat State Branch

An ISO 9001 Certified Organization

President : Acharyashri Devvrat, Hon. Governorshri, Gujarat  
Vice-President : Shri Rushikesh Patel  
Hon'ble Minister of State for  
Health & Family Welfare, Gujarat

Chairman : Shri Ajay H. Patel  
Vice Chairman : Dr. Ajay Kanaiyalal Desai  
Hon. Treasurer : Shri Sanjay Kanchanlal Shah  
General Secretary : Dr. Prakash Parmar

TPP/544

તા. ૧૭/૧૧/૨૦૨૨

આદરણીય વાઈસ-ચાન્સેલરશ્રી,  
ગુજરાત યુનિવર્સિટી,  
અમદાવાદ

વિષય: ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, ગુજરાત રાજ્ય શાખા ધ્વારા  
વિદ્યાર્થીઓના સ્કીનીંગ કરાવવા બાબતનો પરિપત્ર કરવા  
બાબત.. . .

આદરણીય સાહેબશ્રી,

ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત  
આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી મોટામાં મોટી માનવતાવાદી  
સંસ્થાઓમાં એક છે. જન સમુદાયનાં ઉત્થાન માટે ગુજરાત રાજ્ય શાખા અનેકવિધ  
માનવતાવાદી કાર્યક્રમો કરી રહી છે.

ભારત દેશના માનનીય રાષ્ટ્રપતિ ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીનાં પ્રમુખ છે.  
માનનીય કેન્દ્રીય આરોગ્ય મંત્રી ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીનાં ચેરમેન છે. રાજ્ય  
સ્તરે રાજ્યનાં માનનીય રાજ્યપાલશ્રી રાજ્ય રેડ ક્રોસ શાખાનાં પ્રમુખ છે અને  
રાજ્યનાં આરોગ્ય પ્રધાન રાજ્ય રેડ ક્રોસ શાખાનાં ઉપપ્રમુખ છે.

ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા ૩૪ યુનિવર્સિટીઓ સાથે  
સંકળાયેલ છે અને સંસ્થા ધ્વારા જૂજ લોકોનું થેલેસેમિયા પરિક્ષણ કરવામાં  
આવેલ છે જેમાં થેલેસેમિયા માઈનરનું પ્રમાણ ૪ થી ૫ ટકા જણાયુ છે.

ગુજરાત રાજ્યનાં માનનીય રાજ્યપાલશ્રીએ ગુજરાત રાજ્યની તમામ યુનિવર્સિટીનાં  
ઉપકુલપતિશ્રીઓને કોલેજનાં વિદ્યાર્થીઓનું થેલેસેમિયા સ્કીનીંગ રેડ ક્રોસ સંસ્થા  
મારફત કરાવવા ભલામણ તેમજ સુચન કરેલ છે. જે પરિપત્રની નકલ આ સાથે  
સામેલ છે. ઉપરાંત યુનિવર્સિટીનાં કુલસચિવશ્રીઓ ધ્વારા થેલેસેમિયા સ્કીનીંગ  
અંતર્ગત કરવામાં આવેલ પરિપત્રો પણ આપની જાણ સારુ આ સાથે બિડેલ છે.

ગુજરાત રાજ્ય રેડ ક્રોસ શાખા ધ્વારા વર્ષ ૨૦૦૪ થી થેલેસેમિયા પ્રિવેન્શન પ્રોગ્રામ  
શરુ કરવામાં આવેલ છે. ગુજરાત રેડ ક્રોસ ધ્વારા રૂ.૧૫૦/- ટોકન ચાર્જથી  
કોલેજનાં પ્રથમ વર્ષનાં દરેક વિદ્યાર્થીનું થેલેસેમિયા પરિક્ષણ કરવામાં આવે છે.  
અત્યાર સુધી ગુજરાત રેડ ક્રોસ ધ્વારા ૩૫ લાખથી વધારે લોકોનું થેલેસેમિયા  
પરિક્ષણ કરવામાં આવ્યું છે.

Red Cross Bhavan, Nr. Khadi Board, Ashram Road, Old Wadaj, Ahmedabad -13

Ph. : + 91-79-27557055, 27557056, Fax : +91-79-27551790, E-mail : ircsguj@hotmail.com Website : www.redcrossgujarat.org




ગુજરાત રાજ્ય રેડ ક્રોસ સંચાલીત થેલેસેમિયા પ્રિવેન્શન પ્રોગ્રામ ધ્વારા સ્ક્રીનીંગ અંગેના ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજો તથા યુનિવર્સિટીને રીસર્ચ માટે જરૂરી ડેટા પણ પુરા પાડવામાં આવશે.

આથી, ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, ગુજરાત રાજ્ય શાખા ધ્વારા વિદ્યાર્થીઓનું સ્ક્રીનીંગ કરાવવા બાબતનો પરિપત્ર કરવા આપ સાહેબશ્રીને અમારી નમ્ર વિનંતી છે.

આભાર સહ,

રેડ ક્રોસની સેવામાં



અજયભાઈ પટેલ

ચેરમેન

નકલ સવિનય રવાના: આદરણીય કુલસચિવશ્રી, ગુજરાત યુનિવર્સિટી,  
અમદાવાદ.